

## ભારતની ખનીજ સંપત્તિ

ક્રમ	ખનિજનું નામ	ખાણનું નામ અને રાજ્ય	વિશેષ નોંધ
1	લોખંડ (Iron Ore)	સિંગભૂમ (ઝારખંડ), કુદ્રેમુખ ક્ષેત્ર (કર્ણાટક), મયૂરગંજ (ઓડિશા), બસ્તર અને દુર્ગક્ષેત્ર (છત્તીસગઢ)	<ul style="list-style-type: none"> <li>લોખંડના ચાર પ્રકાર જેમાં હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોટાઇટ અને સિડેરાઇટ છે.</li> <li>સૌથી વધારે હિમેટાઇટ ભારતમાં મળે છે. તે ઉચ્ચ કોટિનું લોખંડ જેમાં ગંધકનું પ્રમાણ ઓછું હોય છે.</li> <li>કુદ્રેમુખ ક્ષેત્ર (કર્ણાટક)માંથી નીકળતું લોખંડ ઈરાનને નિકાસ કરવામાં આવે છે.</li> <li>ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાં મળી આવે છે. ત્યારપછી ઓડિશા, ઝારખંડ છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ</li> </ul>
2	કોલસો (Coal)	ઝરિયા(ઝારખંડ), રાણીગંજ(પશ્ચિમ બંગાળ), શિંગરોલી (મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ) તાલચેર (ઓડિશા), નેથવેલ(તામિલનાડું), પાનન્દ્યો કચ્છ (ગુજરાત), કોરબા (છત્તીસગઢ)	<ul style="list-style-type: none"> <li>કાર્બનના પ્રમાણમાં કોલસાના ચાર પ્રકાર જેમાં બિટુમિન્સ, એન્થ્રાસાઇટ, લિગ્નાઇટ અને પીટ કોલસો છે.</li> <li>છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મળે છે.</li> <li>કોલસો જળકૃત ખસકોમાંથી મળે છે.</li> </ul>
3	તાંબુ (Copper)	ખેત્રી (રાજસ્થાન), ઘાટશિલા(ઝારખંડ),	<ul style="list-style-type: none"> <li>ખેત્રી સૌથી જૂની અને જાણીતી ખાણ છે.</li> <li>ભારતમાં સૌથી વધુ તાંબુ ઘાટશિલાના ક્ષેત્રમાંથી મળે છે.</li> <li>ભારતમાં તાંબુ ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન મુખ્ય છે.</li> </ul>
4	સોનું	કોલાર (કર્ણાટક), કેરળ	<ul style="list-style-type: none"> <li>સોનું અઙ્ગિકૃત અને વિકૃત ખસકોમાંથી મળે છે.</li> <li>કોલાર ભારતની સૌથી જૂની સોનાની ખાણ છે.</li> <li>કેરળમાં સોનાના ભંડારો મળે છે.</li> </ul>
5	હીરા	પન્જા (મધ્યપ્રદેશ)	<ul style="list-style-type: none"> <li>ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી પણ મળે છે.</li> </ul>
6	અબરખ (Mica)	હઝારીબાગ, કોડરમા (ઝારખંડ), મોંગેર ક્ષેત્ર (બિહાર), નાઈની (ઉત્તરપ્રદેશ), ગૂંટર, શીંગરેલી (આંધ્રપ્રદેશ), જયપુર, ઉદયપુર(રાજસ્થાન) અને તિરૂવનંતપુરમ (કેરળ)	<ul style="list-style-type: none"> <li>રેતીમાંથી અબરખ મળે તેને માઇકા કહે છે. તે ઉષ્મા અવાહક છે તે ઈસ્ત્રીમાં વપરાય છે.</li> <li>ભારત અબરખ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.</li> </ul>

7	ચૂનાના પથ્થર (Lime Stone)	મકરાના(રાજસ્થાન), રાયપુર(છત્તીસગઢ), સુંદરગઢ (ઓડિશા), કચ્છ,અમરેલી(ગુજરાત),લક્ષદ્વીપના ટાપુઓ	<ul style="list-style-type: none"> <li>• ચૂનાના પથ્થર આ ઉપરાંત મેઘાલય, મણિપુર,અસમ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, કેરળ, જમ્મુ કાશ્મીર, કર્ણાટક માઠી મળી આવે છે.</li> <li>• ગુજરાતમાં સાબરકાંઠા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા,ભાવનગર અને રાજકોટમાં ચૂનાના ખડકો મળી આવે છે.જામનગર જીલ્લામાં મળતાચૂનાના પથ્થરોમાંથી 97% ચૂનાનું તત્વ હોય છે.</li> </ul>
8	બોક્સાઈટ (Bauxite)	રાંચી, પલામૂ (ઝારખંડ), કચ્છ, જામનગર(ગુજરાત), નિલગિરીની પહાડીઓ(તામિલનાડુ), કોલ્હાપૂર રત્નાગિરી(મહારાષ્ટ્ર)	<ul style="list-style-type: none"> <li>• બોક્સાઈટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે.</li> <li>• બોક્સાઈટ સૌપ્રથમ 1821માં ફ્રાંસના લેસ-બાક્સ પાસેથી મળી આવી હતી.</li> <li>• ઝારખંડ કર્ણાટક,ઓડિશા અને ગુજરાતમાંથી પણ મળી આવે છે.</li> </ul>
9	આરસપહાણ		<ul style="list-style-type: none"> <li>• રાજસ્થાનમાં જયપુર, મકરાણા, ચિતોડ, ઉદયપુરમાં મળી આવે છે.</li> <li>• ગુજરાતમાં અંબાજી,ઈડર,શામળાજી અને ખેડબ્રહ્મામાં મળી આવે છે.</li> </ul>
10	યુરેનિયમ	જાદુગોડા ક્ષેત્ર (ઝારખંડ)	<ul style="list-style-type: none"> <li>• જાદુગોડા ક્ષેત્ર ભારતનું યુરેનિયમનું સૌથી મોટું ક્ષેત્ર છે.</li> <li>• 2011માં કોસ્ટલ આંધ્રપ્રદેશમાંથી યુરેનિયમના ભંડારો મળી આવ્યા છે.</li> <li>• હિમાચલપ્રદેશ, ઉત્તરાંચલ અને રાજસ્થાનમાંથી પણ મળી આવે છે.</li> </ul>
11	પેટ્રોલિયમ	દિઝબોઈ (આસામ)	<ul style="list-style-type: none"> <li>• ભારતમાં પ્રથમ પેટ્રોલિયમ ક્ષેત્રનો કૂવો આસામ ખાતે દિઝબોઈમાં આવેલો છે.</li> <li>• બોમ્બે હાઇમાં સૌથી વધુ પેટ્રોલિયમનું ઉત્પાદન થાય છે. ત્યાંથી 1975થી પેટ્રોલિયમ મળે છે તે અરસાગરમાં છે.</li> </ul>
12	સીસું	જાવર (રાજસ્થાન)	<ul style="list-style-type: none"> <li>• સીસાની ધાતુને ગેલેના કહે છે. તે મુલાયમ અને વજનમાં ભારે હોય છે.</li> <li>• ભારતની સૌથી મોટી ઉદયપુર પાસે જાવરની ખાણ આવેલી છે.</li> </ul>
13	મેગેનીઝ (Manganece)		<ul style="list-style-type: none"> <li>• ભારતમાં ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા મુખ્ય ઉત્પાદક છે.</li> <li>• ગુજરાત, મધ્યપ્રદેશ,ગોવા, કર્ણાટક અને પૂર્વના રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે.</li> </ul>